

ધી ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ-૧૯૭૬
નગર રચના યોજના નં.૨(વેસુ-ભરથાણા-વેસુ), સુડા-સુરત. (પ્રારંભિક યોજના)

પુનઃવહેચણી પત્રક



અનુ.નં.	કેસ નં.	માલિકનું નામ	સત્તા પ્રકાર	રે.સ.નં સી.સ.નં.	મુળખંડની વિગત		અંતિમખંડની વિગત		નોંધ
					નંબર	ક્ષેત્રફળ ચો.મી.માં	નંબર	ક્ષેત્રફળ ચો.મી.માં	
	૧	૨	૩	૩(અ)	૪	૫	૬	૭	૮
૯૩	૯૫	બાલકિશન ભવરલાલ રાઠી	-----	૪૧૪/૨	૧૦૦	૧૪૦૦	૧૨૮	૧૨૧૪	-----
૯૪	૯૬	ભાણભાઈ મીઠાભાઈ	-----	૪૧૪/૧	૧૦૧	૧૮૦૦	૧૨૮	૧૩૫૦	-----

Copied by: _____


Compared by: _____

_____ 29/11/2024
Section Officer,
South-West Zone (Athwa)
S. M. C.

_____ 29/11/24
Deputy Engineer,
South West Zone (Athwa)
Surat Municipal Corporation.

PART PLAN OF PRELIMINARY T. P. SCHEME NO. 2 (VESU-BHARTHANA VESU)

FINAL PLOT NO : 128, 129



Copied by: [Signature]
 Compared by: [Signature]

[Signature]
 Section Officer,
 South-West Zone (Athwa)
 S. M. C.

[Signature]
 Deputy Engineer,
 South West Zone (Athwa)
 Surat Municipal Corporation.

LEGEND
 ORIGINAL PLOT BOUNDARY ———
 FINAL PLOT BOUNDARY ———

N
 +
 |
 SCALE : 1CM=20MTS.



સુરત શહેરી વિકાસ સત્તામંડળ, સુરત.

પ્રતિ,
શ્રી દર્શિકા પટેલ
સુરત.

નં.સુડા / ટેક. / ઓ.સર્ટી / ૨૫૩૬૦૦
"સુડાભવન", વેસુ-આભવા રોડ,
વેસુ, સુરત - ૩૯૫૦૦૭
તારીખ:-૨૮/૦૧/૨૦૨૧

વિષય :-ઝોનીંગ સર્ટીફિકેટ બાબત.

અનુ.:-આપશ્રીની તા.૨૨/૦૧/૨૦૨૧ ની અરજી અન્વયે.

ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ ની જોગવાઈઓ મુજબ સરકારશ્રી ના નોટીફિકેશન નંબર જીએચ/વી/૧૫૭ ઓફ ૨૦૨૦/ડીવીપી-૧૪૨૦૧૮-૫૭૩૧-એલ.તા:૦૮/૧૦/૨૦૨૦ તથા CORRIGENDUM નં.જીએચ/વી/૧૭૩ ઓફ ૨૦૨૦/ડીવીપી-૧૪૨૦૧૮-૫૭૩૧-એલ.તા:૦૮/૧૧/૨૦૨૦ થી સુરત શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારની મંજૂર કરાયેલ વિકાસ યોજના-૨૦૩૫ ના અંતિમ ફેરફાર પ્રમાણે મોજે:-.....તા:-.....ના રે.સ.નં./બ્લોક નં./વોર્ડ નં.....સી.સ.નં.....ની જમીનની વિગત નીચે મુજબ છે.
ટી.પી.સ્કીમ નં.૨(વેસુ-ભરથાણાવેસુ)ના ફાયનલ પ્લોટ નં.૧૨૮,૧૨૯ ની જમીન રેસીડેન્સીયલ ઝોનમાં આવે છે.

ઉપરોક્ત જોગવાઈઓને નીચે જણાવેલ અનુ. નં.....(૧,૨)ની વિગતો બંધનકર્તા રહેશે.

(૧) જમીનના નંબર/ક્ષેત્રફળ/માપ/સ્થળસ્થિતિ અધિકૃત દફતર માન્ય રહે છે.

(૨) સદરહુ જમીન ટી.પી.સ્કીમ નં.....૨(વેસુ-ભરથાણાવેસુ)ના વિસ્તારમાં હોવાથી તેની ટી.પી.સ્કીમ હેઠળની અન્ય દરખાસ્ત/જોગવાઈઓ તથા ફેરફારને બંધનકર્તા રહેશે.

નોંધ-"આ ફક્ત ઝોનીંગ સર્ટીફિકેટ છે.
બાંધકામની પરવાનગી નથી."



(Signature)
મદદનીશ નગર નિયોજક
સુરત શહેરી વિકાસ સત્તામંડળ
સુરત.



CHALLAN NO. 253600

DATE :- 22/01/2021

SURAT URBAN DEVELOPMENT AUTHORITY


PART PLAN OF SANCTIONED MODIFICATION DEVELOPMENT PLAN-2035 OF SURAT URBAN DEVELOPMENT AUTHORITY SURAT, UNDER GOVERNMENT NOTIFICATION OF URBAN DEVELOPMENT AND URBAN HOUSING DEPARTMENT, NO. GH/V/157 OF 2020/ DVP-142018-5731-L, DATED. 08/10/2020 AND CORRIGENDUM NO. GH/V/173 OF 2020/DVP-142018-5731-L, DATED. 09/11/2020

T.P. SCHEME NO..2(VESU-BHARTHANA-VESU)

TALUKA :- MAJURA

DISTRICT :- SURAT

THIS PART PLAN IS CERTIFIED FOR THE F.P. NO.:- 128,129



નોંધ : આ જમીનનો સમાવેશ ટી.પી. સ્કીમ નં. ૨ (વેસુ-ભરથાના વેસુ) માં થતો હોવાથી ટી.પી. સ્કીમની અન્ય દરખાસ્તે પણ અરજદારોશ્રીને બંધનકર્તા રહેશે.

જમીનના નંબર / ક્ષેત્રફળ / માપ / સ્થળ-સ્થિતિ બાબત અધિકૃત દફતર માન્ય રહેશે.

LEGEND

- RESIDENTIAL ZONE
- PROPOSED ROAD
- COMMERCIAL ZONE
- WATER BODY

PREPARED BY :-

COMPARED BY :-



TRUE COPY

Assistant Town Planner
Surat Urban Development
Authority, SURAT.



1 CM. = 70 MT.